

## ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિ : ગઈ કાલ અને આવતી કાલ

રતિલાલ બોરીસાગર

ગુજરાતી સાહિત્યમાં અનેક ક્ષેત્રે પ્રારંભ કરી દેખાડનાર નર્મદે 'દ્યારામકૃત કાલ્યસંગ્રહ'નું સંપાદન કરી, ઈ.સ. ૧૮૬૦માં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિના શ્રીગણેશ મંડ્યા. આ પછી ઈ.સ. ૧૮૭૧માં નવલરામે પાઠસમીક્ષાના સિદ્ધાંતોનો વિનિયોગ કરી, 'મામેરું'નું શાસ્ત્રીય ઢબે સંપાદન કર્યું. 'મામેરું'ની પ્રસ્તાવનામાં નવલરામે લખ્યું :

"મુંબઈ ઠિલાકામાં છાપણાનાં નીકળ્યાં ત્યારથી જૂના ગ્રંથ છાપાવા મંડ્યા છે ખરા, પણ આજપર્યત સારોકાર કરવાની જે રીત આપણામાં ચાલી આવી છે, તે ઘણી જ અપૂર્ણ છે. ઘણાએ તો જેવી પ્રત મળી રેવી જ છાપાવી દીધી છે, અને અનું પરિણામ એ થયું છે કે આપણા મહાકવિઓનાં ઘણાં કાલ્ય છાપાયાં છે, પણ તે નહિ જેવાં જ ગણાય છે - તેમકે તે બિલકુલ અશુદ્ધ છે. થોડાએક તો જૂના ગ્રંથના શુદ્ધ થઈ બેઠા અને પોતાની નજરમાં જે સારું લાગ્યું તે પ્રમાણે ફેરફાર કરીને પ્રગટ કરવા મંડી ગયા. એના કરતાં તો હોય તેમજ છાપાવી દેવું એ વધારે સારું કે તેથી બધા લોકોના હાથમાં અશુદ્ધ તો અશુદ્ધ પણ જૂની પ્રતની એક ખરી નકલ તો આવે. પણ પ્રગટ કરનારે જ્યાં સ્વચ્છટે ફેરફાર કરી દીધો હોય છે ત્યાં તો અસલાનું કયું અને પેલાએ પોતાનું ધોંચી ઘાલ્યું છે તે કયું એ જાણલું બિલકુલ અશક્ય થઈ પડે છે અને તેથી તે પ્રતના સાચાપણા ઉપર કાંઈ પણ ભરોસો રાખી શકતો નથી."

આ પછી લગભગ સો વરસ બાદ ડૉ. હરિવલભ ભાયાણી લખે છે :

"...આજ સુધીમાં સેકડો પ્રાચીન મુખ્યકાલીન ગુજરાતી (તેમજ ઓછે અંશે સંસ્કૃત, પ્રાકૃત વગેરે) કૃતિઓનું સંપાદન થયું છે. પણ આજ્યની વાત એ છે કે ગુજરાતી કૃતિઓનાં સંપાદનની સમસ્યાઓની તથા શાસ્ત્રીય પદ્ધતિ અને ધોરણોની વ્યવસ્થિત ચર્ચા કે વિવરણ કરવાનું આપણને આવશ્યક લાગ્યું નથી. સંપાદનશાસ્ત્રનું એક પણ પુસ્તક ગુજરાતીમાં નથી.

"... ગ્રંથસંપાદનનું લક્ષ્ય બધી ઉપલબ્ધ સામગ્રીને આધારે કૃતિના મૂળ પાઠ સુધી પહોંચાવનું હોય છે. જાણેબજાડ્યે પ્રવેશોત્તા ફેરફારોનો પરિહાર સાધીને શબ્દસ્વરૂપ, શબ્દયોજના, છંદ વગેરે પરત્વે મૂળ કૃતિનો સાંગોપાંગ

સ્વરૂપનિર્ણય કરવાનો હોય છે...

“પાઠાંતરોમાંથી અમૃકને જ કેમ પસંદગી આપી તેનાં કારણોનો ઉલ્લાપોહ સંપાદકે આવશ્યકતા પ્રમાણે સ્થળેસ્થળે કરવાનો હોય છે... પ્રાચીન સાહિત્યના સંપાદનમાં આપણે આ બધું ઠીકઠીક ઉવેંઝું છે. જ્યાં એક પ્રતથી ચાલે તેમ લાયું છે ત્યાં વધું પ્રતો જોવાની ચિંતા નથી. કરી, જ્યાં એકાધિક પ્રત ઉપયોગમાં લેવાઈ છે, ત્યાં ઉપલબ્ધ બધી પ્રતો જોવાનું જરૂરી નથી માન્યું. ઉપર્યુક્ત પ્રતોનાં પાઠાંતરો યથાતથ ચીવટ્યી નથી નોંધવાયાં. હાથ લાગી તે પ્રતને શાકતા ફેરફાર જાયે છાપી નાખવાને બદલે બધી (કે બધી મહાત્માની) પ્રતો ઉપયોગમાં લેવાનો અને પાઠાંતરો હોય તેવાં જ ચુસ્તપણે નોંધવાનો જોકે વધું આગ્રહ (સિદ્ધાંતમાં વિશેષ, વ્યવહારમાં સગવડ પ્રમાણે) રખાય છે. છતાં પ્રતોનો આંતરસંબંધ નક્કી કરવાનું, પાઠપસંહીનાં ધોરણો આપવાનું, છંદ અને ભાષાભૂમિકાને આલોચક દસ્તિએ પાઠનિર્ણયમાં ઉપયોગમાં લેવાનું અને વ્યવસ્થિત પાઠાંતરચર્ચા કરવાનું વધતે-ઓછે અંશે અનાવશ્યક ગણીને કે અશાનને કારણે છોડી દેવાય છે. પરિષામે પૂરતા પ્રમાણિક કે માન્ય ગણી શકાય તેવાં પાઠને બદલે ઠીકઠીક અંશે અત્મલક્ષી ધોરણો અને અંગત રુચિએ ઘટાડેલા પાઠ આપણાને મળતા રહે છે.”<sup>૨</sup>

એક શૈક્ષા જેટલો સમયગાળો પસાર થયા પછી થયેલી ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિનો ઉપરોક્ત સર્વગ્રાહી સમીક્ષામાં માત્ર વીગત અને ભાષાનો જ ફેર દેખાય છે, ભાવ અનો એ જ છે. અલભાન, આનો અર્થ એવો નથી જ કે પાઠસમીક્ષાપ્રવૃત્તિમાં આપણે ત્યાં કશું કામ થયું નથી કે આટલા લાંબાં સમયગાળામાં આપણાને તેજસ્વી સંપાદકો મળ્યા નથી. નર્મદ અને નવલરામ જેવાએ પાઠસમીક્ષાપ્રવૃત્તિનો સંગીન પાયો નાખ્યો. આ પછી ઠિચ્છારામ સૂર્યરામ દેશાઈ, મોહનલાલ દલીયંદ દેશાઈ, કે. હ. ધૂલ, સી. ડી. દલાલ, મુનિ જિનવિજયશ્શ, કે. કા. શાસ્ત્રી, બોગીલાલ સાંડેસરા, મગનભાઈ દેશાઈ, મંજુલાલ મજૂમુદાર, અનંતરાય રાવળ, કે. બી. વ્યાસ, હરિવલભ ભાયાણી, રમશ્લાલ ચી. શાહ, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ નિવેદી, ઉમાશંકર જોશી, શિવલાલ જેસલપુરા જેવા વિદ્ધાન સંપાદકો આપણાને મળ્યા છે. શાસ્ત્રીય દસ્તિએ તંતોતંત ખરાં ઊતરે એવાં કેટલાંક સંપાદનો પણ આપણે ત્યાં થયાં છે. પ્રમાણની દસ્તિએ તો ઘણું કામ થયું છે એમ કહેવાય. પરંતુ ગુજરાતી પાઠસમીક્ષાનું ગુણાત્મક ચિત્ર એકદરે ગ્લાનિપ્રેરક છે એમ સ્વીકાર્ય વગર છૂટકો નથી. આનાં કેટલાંક કારણો પડ્યા છે; જેમકે, હસ્તપતોમાં સચ્ચવાયેલ આપણા મધ્યકાળીન સાહિત્યવારસ માટે આપણાને એક પ્રજા તરીકે હોવું જોઈએ એટલું ગૌરવ ક્ષારેય હતું નહીં, કદાચ આજેય નથી. આપણી મહામૂલી હસ્તપતોની લેલી જોઈએ એટલી કાળજી

૨. ડૉ. હરિવલભ ભાયાણી, અનુસંધાન, સંશોધન, પૃ. ૭ અને ૮

આપણો ક્યારેય લીધી નથી - ખાસ કરી જૈનેતર સાહિત્યની હસ્તપ્રતોની જે દુર્દીશા આપણો ત્યાં થઈ તેનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. યુનિવર્સિટીની કચરાપેટીમાંથી કે પસ્તી વેચતા ફેરિયા પાસેથી હસ્તપ્રતો મળી છે. પાઠસમીક્ષાનું કામ એકલદોકલનું કામ નથી. આવું કામ સંસ્થાકીય ધોરણે જ ઉત્તમ રીતે થઈ શકે. પણ એ માટે સંસ્થાઓ પાસે પૂર્તાં નાણાભંડોળ હોવું જોઈએ. આપણો ત્યાં સંસ્થાકીય ધોરણે કેટલુક કામ થયું છે પણ જૈનેતર સાહિત્યના સંપાદનકાર્યમાં આર્થિક પ્રશ્નોએ સંસ્થાઓને ખૂબ મુશ્કીલી છે. આપણા સંપાદકોને સહાયકોની સેવા ક્યારેય ઉપલબ્ધ નહોતી. કમ્પ્યુટર જેવા આધુનિક સાધનનો વિનિયોગ આ સદી પૂરી થવા આવી તોય હજુ શરૂ થયો નથી. મ. સ. યુનિવર્સિટી સિવાય ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓએ આ કાર્યને ગંભીરપણે પોતાનું કાર્ય માન્ય નથી.

પાઠસમીક્ષાપ્રવૃત્તિની ગઈ કાલ એટલી ઉજમાળી નથી તો આવતી કાલ અંગે પણ આપણો એટલા આશાવંત બની શકીએ એવી સ્થિતિ નથી. આ ક્ષેત્રના આપણા ઉત્તમ સંપાદકોમાંથી આજે હ્યાત હોય એવા સંપાદકોની ઉમર ધર્ણી મોટી છે. એમની પછીની પેઢીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ચિમનલાલ ત્રિવેદી કે જીયંત કોઠારી જેવા અભ્યાસીઓ પણ સિતેરના થવા આવ્યા છે. એમની પછીની પેઢીના અધ્યાપકોમાં મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ પરતેનું વલણ ઓછું ટેખાય છે. આ સંજોગોમાં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિને ઉગારવા કશીક નક્કર વિચારણા કરવાની આવશ્યકતા છે. આ દિશામાં શુંશું થઈ શકે તે અંગે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે :

(૧) પાઠસમીક્ષાપ્રવૃત્તિ માટે એક મધ્યવર્તી સંસ્થાની તાતી જરૂર છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ હોદાની રૂએ આ સંસ્થાના સભ્ય હોય. આ ક્ષેત્રના અધિકારી વિદ્ધાનો આ સંસ્થાના માનુષ સભ્ય હોય. મકાન, સાધનો વગેરે માટે રાજ્ય સરકાર સહાય કરે. કાયમી સ્ટાઇના પગાર પર રાજ્ય સરકાર સો ટકા ગ્રાન્ટ આપે. ગ્રંથસંપાદન અને પ્રકાશનના ખર્ચ પર પચાસ ટકા ગ્રાન્ટ આપે અને બાકીનો ખર્ચ સંસ્થા સમાજ પાસેથી મેળવે. આ તો માત્ર સૂચન છે. સંસ્થાનો નિર્વાહ વીગતનો પ્રશ્ન છે. એ અંગે સામાન્ય અભિપ્રાય મેળવી યોગ્ય નિર્ણય થઈ શકે. મુખ્ય વાત આવી સંસ્થા હોવી જોઈએ તે જ છે. જૈન કે જૈનેતર એવા કશા બેદભાવ વગર મધ્યકાલીન ગુજરાતી ગ્રંથોના સંપાદનની પ્રવૃત્તિ આ સંસ્થા હાથ ધરી શકે. (૨) ઉપલબ્ધ તમામ ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી આ સંસ્થા દ્વારા વેળાસર કરાવી લેવામાં આવે. (૩) નવી પેઢીના તેજસ્વી અધ્યાપક-શિક્ષકોને સંપાદનપદ્ધતિની વ્યવસ્થિત તાલીમ આ સંસ્થા દ્વારા આપવામાં આવે. અધ્યાપક-શિક્ષકની નિપુંગી વખતે આ સંસ્થાના તાલીમપ્રમાણપત્રનો

વધારાની યોગ્યતા રૂપે સ્વીકાર કરવામાં આવે. (૪) એમ. હિલ. કક્ષાએ મધ્યકાળીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનની વ્યવસ્થા ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં હોવી જોઈએ. કે રીતે ભાષાવિજ્ઞાનમાં અનુસ્નાતક અભ્યાસ પણીના ડિપ્લોમા અભ્યાસકર્મની વ્યવસ્થા છે તે રીતે મધ્યકાળીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનના ડિપ્લોમા અભ્યાસકર્મની વ્યવસ્થા પડી થવી જોઈએ. મધ્યકાળીન સાહિત્ય ભાષાવવા માટેની અધ્યાપકની યોગ્યતામાં સ્નાતક કક્ષાએ ભાષાવવા માટે ડિપ્લોમા કક્ષાનો અને અનુસ્નાતક કક્ષાએ ભાષાવવા માટે એમ.હિલ. કક્ષાનો આ પ્રકારનો અભ્યાસ અનિવાર્ય ગણાવો જોઈએ. (૫) પાઠસમીક્ષાપ્રવૃત્તિ માટે ક્રમયુટરનો વિનિયોગ થવો જોઈએ. આ માટેની તાલીમની વ્યવસ્થા મધ્યવર્તી સંસ્થા દ્વારા કરવી જોઈએ. આપણી તમામ હસ્તપત્રોને ફ્લોપીઓમાં સંગૃહીત કરી લેવાનું સૂચન આજે થોડું અવાસ્તવિક અને અધ્યવહારું લાગશે. પણ એકવીસમી સદીની પહેલી પચ્ચીસીમાં એ એટલું અઘરું નહિ લાગે.

આ તો માત્ર દિશાસૂચન છે. મુજ્ય વાત તો મધ્યકાળીન સાહિત્યવારસાને સાચવવાની ચિંતા કરનારાનું સંકલ્પબળ એકત્રિત થાય તે જ છે.

